

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા સચિવાલયના જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ ભરવા માટે તા. ૨૫/૦૭/૨૦૧૯ ના રોજ સંયુક્ત જા.ક. ૧૫૨/૨૦૧૮૧૯ થી ૧૬૬/૨૦૧૮૧૯ પ્રસિદ્ધ કરી લાયક ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીપત્રકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ઉક્ત અરજી પત્રકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી દરમ્યાન તેમજ ત્યારબાદ જા.ક. ૧૬૧/૨૦૧૮૧૯, સર્વેચર સંવર્ગની શૈક્ષણિક લાયકાત સંદર્ભે કેટલાંક ઉમેદવારો તરફથી આ સંવર્ગના ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતના એક વિકલ્પમાં “ઉમેદવાર આઈટીઆઈ માંથી ૨૪ માસનો (બે વર્ષનો) સર્વેચરનો કોર્સ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે.” એ પ્રમાણેની જોગવાઈ છે, પરંતુ સરકારશ્રી દ્વારા આઈટીઆઈમાં ચાલતા સર્વેચરના તાલીમી કોર્સમાં કેટલાંક વર્ષોથી ફેરફાર કરીને ઉક્ત તાલીમી કોર્સ એક વર્ષનો કરવામાં આવેલ છે. તેથી એક વર્ષનો તાલીમી કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ભરતી નિયમોમાં સુધારો કરી એક વર્ષનો તાલીમી કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે. તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ મંડળને રજુઆત કરવામાં આવેલ હતી. જે અન્વયે ઉદ્યોગ અને ખાણ વિભાગે તા. ૨૩/૦૧/૨૦૨૦ ના જાહેરનામાથી ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરેલ છે. જેની વિગતો નીચે દર્શાવેલ સુધારા મુજબ છે. તેથી તે સુધારા મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ હવે તા. ૧૬/૦૩/૨૦૨૦ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૩૦/૦૩/૨૦૨૦ (રાત્રીના ૨૩:૫૯) સુધી ઓનલાઇન અરજીપત્રક ભરી શકશે.

સુધારા જાહેરાત

જા. ક. ૧૬૧/૨૦૧૮૧૯ - સર્વેચર

મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ, ગાંધીનગર હસ્તકના સર્વેચર સંવર્ગની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ માટે તા. ૨૫/૦૭/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંયુક્ત જા.ક. ૧૫૨/૨૦૧૮૧૯ થી ૧૬૬/૨૦૧૮૧૯ પૈકીની જા.ક. ૧૬૧/૨૦૧૮૧૯ માટે ઉક્ત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૧૨-૧૩ પર વર્ણવવામાં આવેલ શૈક્ષણિક લાયકાતમાં (ખ) (૧) માં મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગે તા. ૨૩/૦૧/૨૦૨૦ ના જાહેરનામાથી સુધારેલ ભરતી નિયમોની જોગવાઈ આધારે નીચે દર્શાવ્યા પ્રમાણેનો સુધારો બહાર પાડવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

જાહેરાતના ફકરા નં. ૪ (૧) માં જા.ક. ૧૬૧/૨૦૧૮૧૯ ની શૈક્ષણિક લાયકાતના (ખ) (૧) માં દર્શાવેલ વિગતો	સુધારા મુજબની વિગતો
(ખ) (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એક્ટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીઝ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સીવીલ એન્જિનિયરીંગ નો ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે. અથવા	(ખ) (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એક્ટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીઝ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સીવીલ એન્જિનિયરીંગ નો ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે. અથવા
(૨) સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ૨૪ માસનો (બે વર્ષનો) સર્વેચરનો કોર્સ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે	(૨) સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી સર્વેચરનો તાલીમી કોર્સ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે

(૧) આ સુધારા જાહેરાત અન્વયે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય મુદ્દાઓ માટેની નિયત કટ ઓફ તારીખ મુળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તા.૨૪/૦૮/૨૦૧૯ રહેશે. જ્યારે EWS અને SEBC કેટેગરીના ઉમેદવારો માટે અનુક્રમે EWS પાત્રતા પ્રમાણપત્ર અને નોન કિમિલેચર સર્ટીફિકેટ માટેની કટ ઓફ તારીખ ૩૦/૦૩/૨૦૨૦ રહેશે.

(૨) જા.ક. ૧૬૧/૨૦૧૮૧૯ ના તમામ ઉમેદવારો માટે તા. ૨૫/૦૭/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં વર્ણવ્યા મુજબની અન્ય તમામ સૂચનાઓ અને શરતો યથાવત રહેશે.

(૩) આ સુધારા જાહેરાત અન્વયે સંબંધિત ઉમેદવારો પોતાની ઉમેદવારી તા.૧૬/૦૩/૨૦૨૦ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૩૦/૦૩/૨૦૨૦ (રાત્રિના ૨૩:૫૯ કલાક) સુધીનો રાખવામાં આવેલ છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તા. ૦૪/૦૪/૨૦૨૦ (બપોરના ૧૫:૦૦ કલાક) સુધીનો રહેશે.

સ્થળ:- ગાંધીનગર

તારીખ- ૧૩/૦૩/૨૦૨૦

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર